વર્ષ ૪૨, એપ્રિલ-૨૦૧૧, અંક-૪, આજીવન લવાજમ રૂા. ૨૦૦/-

સંસ્કાર દીપ

પ.પૂ.ગુરુવર્ય શાસ્ત્રીજી
મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી
તથા
વાત્સલ્યમૂર્તિ પરમ પૂજ્ય
સદ્‌ગુરુ પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી

: આશીર્વાદ :
અખંડ ભગવદ્ પરાયણ પ.પૂ. શ્રી જોગીસ્વામી
: અધ્યક્ષ :
પ.પૂ. સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી
: પ્રેરણા :
પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
મુદ્રક : સુર્યા ઓફસેટ, આંબલી, અમદાવાદ-૫૮

: તંત્રી :
શ્રી લક્ષ્મણભાઇ આઢ્રોજા
: સંપાદક :
શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી
: કલા સંયોજન :
ગોવિંદ જી. બાંટવા

: પ્રકાશક :
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ
વિદ્યાર્થી સંઘ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ,
મેમનગર, અમદાવાદ - ૩૮૦ ૦૫૨
સંપર્ક : (૦૭૯) ૨૭૯૧૨૫૯૧
૯૮૨૫૨૧૦૦૩૮, ૯૮૨૫૩૧૫૦૩૦
www.swaminarayangurukul.org
E-mail :sgvpgurukul@gmail.com

મારે પણ સલાહ આપવી છે

- શાસ્ત્રી મુનિવત્સલદાસ

માગ્યા વિના વિનામૂલ્ય અઢળક મળતી સંપત્તિ એટલે ‘સલાહ’. જે માણસમાત્રની મોટામાં મોટી કુટેવ છે, વિના કારણ બીજાને સલાહ આપવી. મોટા ભાગના માણસોના દશ વાક્યોમાં સરેરાશ આઠ વાક્યો બીજાને માટે જ હોય છે. મોટા ભાગના લોકો ‘મારે શું કરવું જોઇએ?’ એ વિચારવાને બદલે ‘બીજા લોકોએ શું કરવું જોઇએ?’ એ જ વિચારતા હોય છે. એટલે જ માણસ પોતાનું જીવન સુધારી શકતો નથી. એક લેખકે ખૂબ સરસ લખ્યું છે કે જીવન સુધારણાની પહેલી શરત છે **“તમે જે સલાહ બીજાને આપો છો તે સલાહ પોતાની જાતને આપો.”** માણસ બીજાને સલાહ આપવામાં જેટલો સમય વ્યતીત કરે છે તેટલો સમય પોતાનું જીવન સુધારવામાં વાપરતો નથી, આથી જ મોટા ભાગના લોકાનું જીવન સમાજને સુધારવામાં જ પૂર્ણ થઇ જાય છે. વ્યક્તિ બીજાને આપેલી સલાહનું સ્વયં પાલન કરવા લાગે તો તેની પાસે બીજાને સલાહ આપવાનો સમય જ ન વધે.

આધુનિક વ્યક્તિના જીવનમાં ‘સલાહ એક મણ અને પાલન એક કણ’ જેટલું જોવા મળે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ એટલે ઋષિઓ અને રાજાઓની સંસ્કૃતિ. એ સમયમાં ઋષિઓના પગલે પગલે શિષ્યો ચાલતા અને પ્રજા રાજાની દરેક આજ્ઞાનું અનુસરણ કરતી. આજે સમાજમાં વિપરીત પરિસ્થિતિનું દર્શન થાય છે. ગુરુઓ શિષ્યને આધીન થયા છે અને રાજા પ્રજાની પાછળ દોડે છે. શિષ્યો ગુરુને સલાહ આપે છે. સલાહ આપવી માણસમાત્રની સહજ સ્વાભાવિક પ્રકૃતિ બની ગઇ છે. અને મફત મળતુ હોય તે લેવા માણસ સદા તત્પર પણ રહે છે. આ સંપૂર્ણ જગતમાં સૌથી સહેલાઈથી મળી રહે તેવી અને સસ્તામાં સસ્તી વસ્તુ છે ‘સલાહ’. જ્યારે વ્યક્તિ સામેથી સલાહ માગે અને પોતાને એ ક્ષેત્રની માહિતી હોય તો જ સલાહ આપવી તે બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ છે.

આજના માણસની કર્તવ્યપરાયણતા કર્તવ્યપલાયનતામાં પરિણમી છે. કોઇ પણ કાર્ય માટે સલાહ આપનારા હજારો લોકો મળશે પણ એ કાર્યને સારી રેતી પૂર્ણ કરનાર કોઇક જ મળે છે. આજના ભિખારીને પણ જો શિક્ષણ જગતમાં કેવા ફેરફારો કરવા જોઇએ ? એ અંગે પૂછવામાં આવે તો સારામાં સારી સહજતાથી સલાહ આપશે. સલાહ આપતી વખતે લોકો પોતાનું ક્ષેત્ર કે અધિકાર જોતા જ નથી. અધિકાર કે પાત્રતા વિના આપેલી સલાહ સફળ થતી નથી. સલાહ આપતી વખતે લોકો અલગ અલગ યુક્તિઓનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો તો હું સલાહ નથી આપતો એમ કહીને પણ સલાહ આપતા હોય છે. ઘણા લોકો ‘મારું એવું માનવું છે કે’ એમ કહીને સલાહ આપે છે. અને બીજાને પણ પોતાની માન્યાતાને આધીન કરવાનો પ્રયત્ન કરે છે. ઘણા લોકો ‘મેં એવુ સાંભળ્યુ છે કે’ એમ કહીને સલાહ આપે છે પરુંતુ તેનું સાંભળેલું તેની પાસે રાખી શક્તો નથી

એવુ નથી કે સલાહ આપવી દૂષણ છે, પરંતુ યોગ્ય વ્યક્તિએ યોગ્ય સમયે આપેલી સાચી સલાહ જીવનપરિવર્તન કરી શકે છે. માફ કરજો આ પણ મારી માગ્યા વિના આપેલી એક સલાહ જ છે.

વ્હાલા બનીએ વાલમજીને

- શાસ્ત્રી નિરંજનદાસ

"મયુર ટહુકા કરી પુકારે રંગ બદલાવવા મેઘરાજને,
તેમ પ્રેમીજનના હૃદય પુકારે વ્હાલા બનવા વાલમજીને"
વ્હાલ એટલે હેત, વ્હાલ એટલે પ્રેમ,
વ્હાલ એટલે હૃદયની કોમળ લાગણી.

"**પ્રેમ**" શબ્દ આપણને ભૌતિક લાગે જ્યારે "**વ્હાલ**" શબ્દ ભાવભર્યો લાગે. "**વ્હાલા બનીએ**" ફક્ત એટલો શબ્દ સાંભળતા જ સહુના હૃદયમાં આનંદ આનંદ થઈ જાય, કારણકે કોઈકના વ્હાલા થવાની તો દરેકને ઈચ્છા હોય જ છે. **વ્હાલા બનવું** એટલે કે **જેના વ્હાલા થવું હોય, તેનાં ગમતામાં રહેવું**. જે હેતરૂપી માયાથી આ સંસારનું ચક્ર ચાલે છે, એ જ હેતરૂપી વ્હાલથી આ સંસારચક્રને ભેદી પણ શકાય છે. પણ શરત એટલી જ કે એ વ્હાલ **વાલમજી** તરફ વહેવું જોઈએ. આ **વાલમજી** એટલે **સર્વના આધાર એવા ભગવાન**, કે જેને વ્હાલ કરવાનું સૌને ગમે. અરે ! એટલું જ નહિ, પરંતુ જે બધાના વ્હાલને સ્વીકારી શકે તથા જે પોતે વ્હાલના સાગર સમાન છે, એવા **શ્રીઘનશ્યામ મહારાજ** આપણા સૌના વાલમજી છે. આવા આ વાલમજીને વરવા માટે જ આપણને આ અમૂલ્ય મનુષ્યનો દેહ મળ્યો છે. અરે ! આવા વાલમજીને વ્હાલા થવાનું પરમ સૌભાગ્ય આપણને સૌને સત્સંગ દ્વારા પ્રાપ્ય થયું છે. માનવમાત્રને પરમાત્માએ હૃદય આપેલું છે, આથી માનવમાત્ર બુદ્ધિશાળી જ નહિ, પરંતુ લાગણીશીલ પણ છે. આ લાગણીઓના પૂર માણસના હૃદયમાં આવે છે.

જેને સત્સંગ નથી થયો, તેનું વ્હાલ તેના સગાં-સંબંધીઓમાં કહેતા માતા, પુત્ર, પત્ની વગેરે તરફ વહે છે, પરંતુ જેને મહામુલા એવા આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે, એવા સદ્‌ભાગી આત્માઓના વ્હાલની સરિતા તો ભગવાન તરફ જ વહે છે.

તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે, આવા આ વાલમજીને કાયમી માટે વ્હાલા થવા માટે આપણે શું કરવું જોઈએ ? આવા આ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણને હંમેશા વ્હાલા બની રહેવા માટે તો સૌપ્રથમ આપણે **સદ્‌ગુરુની અનુવૃત્તિમાં રહેવું જોઈએ**. જે સદ્‌ગુરુએ આ વાલમજીનો માર્ગ બતાવ્યો છે, તેમની આજ્ઞામાં માત્ર સ્થૂળરૂપે જ નહિ, પરંતુ મન, કર્મ અને વચનથી રહેવું જોઈએ. એ સદ્‌ગુરુની ઈચ્છા પ્રમાણે તેમના અંતરના આદેશ અનુસાર જેમ વાળે તેમ વળવું જોઈએ.

સદ્‌ગુરુની કૃપાથી આપણા અંતરના અરમાનો ભગવાન તરફ બની રહે છે. અને આથી જ તો આપણને વાલમજીની વાટ જડે છે. અરે ! **પ્રેમસખી પ્રેમાનંદસ્વામી** જ્યારે ગાય કે, "**વાલમજી વહેલા વળજો ગઢપુર**" ત્યારે વાલમજી તરત જ અટકી જાય છે, કારણકે વ્હાલ પરમાત્માને પણ વશ કરી લે છે. એ ગઢપુરના પ્રેમીભક્તો **લાડુબા**, **જીવુબા** વગેરે વ્હાલથી જ્યારે મહારાજને સંબોધતા કહે છે કે, હે અમારા પ્રાણપ્રિય વાલમજી ! જલ્દી જલ્દી ગઢપુર પાછા પધારજો. ત્યારે વાલમજી પણ વિચારતા થઈ જાય છે કે, હવે અહિંથી કેમ કરીને જવું ? અરે ! એટલું જ નહિં, પરંતુ વાલમજી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં પાતાના પ્રેમીભક્તોની આજ્ઞા માગતા કહે છે કે, "**આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી**". આ ભક્તો વ્હાલપના આદર્શો છે, કે જેઓ પોતાના વ્હાલથી સર્વેશ્વર પરમાત્માને પણ રોકી શકે છે. ગોપીઓ પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં ગાંડી બની ત્યારે એને જગત-વ્યવહારનું કંઈ ભાન રહ્યું નહોતું. ભગવાન સાથેના પરમ પ્રેમમાં જગત ભૂલાઈ જાય છે અને માત્ર વાલમજીનું સ્વરૂપ જ રહે છે. આથી જ તો વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે, "**જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ તેને સર્વે સાધન સંપૂર્ણ થયા, તેને હવે કાંઈ કરવાનું બાકી રહેતું નથી.**" અરે! એટલું જ નહિ ભગવાન શ્રીકૃષ્ણ પણ શ્રીમદ્‌ભગવદ્‌ગીતામાં એવા પ્રેમી ભક્તો ભગવાનને અતિશય પ્રિય છે એવું વર્ણવતા કહે છે કે,

मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥

ભગવત્પ્રેમ એ સર્વોચ્ચ સાધના છે. સત્સંગ, સેવા અને સમર્પણ દ્વારા આપણે તેને પ્રાપ્ત કરીએ એમાં જ જીવનની સાર્થકતા છે. જે વ્હાલપણું ગોકુળના ગોપ-ગોપીઓને અને ગાયોને પ્રાપ્ત થયું તથા જે વ્હાલપણું દાદાખાચરના દરબારમાં પ્રેમીભક્તોને અને પરમહંસોને પ્રાપ્ત થયું એ વાલમજીનું વ્હાલભર્યુ વ્હાલપણું આપણે પણ પ્રાપ્ત કરીએ એજ અભ્યર્થના. ●●●

સંસ્થા સમાચાર

પૂર્ણવિદ્યા ગ્રંથ વિમોચન :-

વિદ્યાનિધિ ટ્રસ્ટ આયોજિત પૂર્ણવિદ્યા જાગૃતિ અભિયાન અને પૂર્ણવિદ્યા ગ્રંથમાળાની ગુજરાતી આવૃત્તિનું વિમોચન તા. ૫ માર્ચ, ૨૦૧૧ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાખવામાં આવ્યું હતું. આ ગ્રંથમાળાનું ભાષાંતર પૂ. સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીજીના શિષ્યોએ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. પ. પૂ. દયાનંદ સરસ્વતીજીનાં સાન્નિધ્યમાં વિમોચન થયેલ પુસ્તકનો સેટ માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમનું તમામ આયોજન પ. પૂ. પરમાત્માનંદજી મહારાજે કર્યું હતું.

ભૂમિપૂજન – રાજકોટ :-

રાજકોટ નજીક કુવાડવા પાસેની બેટી નદીના કુદરતી સૌંદર્યથી ભરેલા રમણીય કિનારે 'રાધે ગોલ્ફ વિલેજ' સ્કીમનું ભૂમિપૂજન પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ. પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે તા. ૯ માર્ચ, ૨૦૧૧ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'રાધે ગોલ્ફ વિલેજ' સ્કીમના ભાગીદારો શ્રી પરેશભાઈ પટેલ, શ્રી નિલેષભાઇ લુણાગરીયા, શ્રી ઘનશ્યામભાઈ હેરભા તથા શ્રી રાજેન્દ્રભાઈ રાવલ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદને ૩૩ એકર જમીન દાનમાં આપવાનો સંકલ્પ જાહેર કરતાં ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે હર્ષભેર આ સંકલ્પને વધાવી લીધો હતો. આ પ્રસંગે પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુકુલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવું આ શ્રેષ્ઠ દાન છે. અર્પણ થયેલી આ ભૂમિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલી અનેકવિધ સર્વજીવ હિતાવહ પ્રવૃત્તિઓ થશે તેમાં તમે નિમિત્ત બન્યા છો.

શ્રીમદ્ ભાગવત કથા – મુંબઇ :-

પ. પૂ. પાર્ષદવર્ય શ્રી નારાયણ ભગતની પવિત્ર સ્મૃતિમાં ગુરુકુલ પરિવાર, મુંબઇ દ્વારા ઘાટકોપર ખાતે 'શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ'નું આયોજન તા. ૯ થી ૧૩ માર્ચ, ૨૦૧૧ દરમિયાન થયું. પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને યોજાયેલ આ કથા દરમિયાન ભાગવત કથા અંતર્ગત આવતા જુદા જુદા ઉત્સવો ધામ ધૂમથી ઉજવવામાં આવ્યા હતા. આ કથા પ્રસંગે પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી કથાવાર્તાનો લાભ આપ્યો હતો. આ પાવકારી પ્રસંગે પ. પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પ. પૂ. સદ્‌ગુરુ શ્રીહરિદાસજી સ્વામી, પ. પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, વડતાલથી પૂ. ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, પૂ. નીલકંઠચરણદાસજી સ્વામી, ભૂલેશ્વરથી સંત સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહી કથાવાર્તાનો લાભ આપ્યો હતો.

શ્રીમદ્ ભાગવત કથા- માખાવડ :-

પ. પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પ. પૂ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પ. પૂ. અખંડ ભગવદ્ પરાયણ શ્રી જોગી સ્વામી જેવા મહાપુરુષોની ચરણરજથી પવિત્ર થયેલી ભૂમિ ગામ માખાવડ ખાતે ગૌસેવાના ઉદ્દેશ્યથી તા. ૧૩ થી ૧૯ માર્ચ, ૨૦૧૧ સુધી પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તા. ૧૭ માર્ચના રોજ પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા તા. ૧૮ માર્ચના રોજ ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાએ સત્સંગનો લાભ આપ્યો હતો. આ પાવન પ્રસંગે પ.પૂ. અખંડ ભગવદ્ પારાયણ શ્રી જોગીસ્વામી માખાવડ પધારતા સ્વામીના દર્શન કરી સહુ હરીભક્તો ધન્યભાગી બન્યા હતા. આ ઉપરાંત વડતાલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે ધામોમાંથી અનેક સંતોએ પધારી દર્શન તથા કથાવાર્તાનો લાભ આપ્યો હતો. આ કથાનું સંપૂર્ણ આયોજન માખાવડ ગામના સમસ્ત ગ્રામજનોએ સાથે મળીને કર્યું હતું.

પુષ્પદોલોત્સવ- આમદાવાદ ગુરુકુલ :-

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવદ ખાતે તા. ૨૦ માર્ચ, ૨૦૧૧ ના રોજ પ.પૂ. અખંડ ભગવદ્ પરાયણ શ્રી જોગીસ્વામીના સાનીધ્યમાં પુષ્પદોલોત્સવ ખૂબજ ધામ ધૂમપુર્વક ઉજવવામાં આવ્યો હતો. મહોત્સવના પ્રારંભે ગુરુકલ ગાયક વૃંદ દ્વારા રંગોત્સવના કીર્તનોનું ગાન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સદ્‌ગુરુ સંતોના હસ્તે રાજાધીરાજ ઘનશ્યામ મહારાજનો પુષ્પોવડે અભિષેક તથા પીચકારી દ્વારા રંગોનો છટકાવ કરવામાં આવ્યો હતો. સંતોના મુખેથી કથાવાર્તાનું શ્રવણ, ફગવારુપી પ્રસાદ, પ.પૂ. અખંડ ભગવદ્ પારાયણ શ્રી જોગીસ્વામીના દર્શન કરી સહુ હરીભક્તો ધન્યભાગી બન્યા હતા

આજરોજ પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ. પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી દ્વાર તા. ૨૫ થી ૩૧, ડીસેમ્બર, ૨૦૧૨ દરમિયાન , પ.પૂ. અખંડ ભગવદ્ પારાયણ શ્રી જોગીસ્વામીના ૧૦૮ વર્ષ પૂર્ણ થતા **"સદ્‌ગુરુ વંદના મહોત્સવ"** ઉજવવામાં આવશે તેવી જાહેરાત થતા સહુના હ્યદય આનંદથી નાચી ઉઠ્યા હતા અને સહુએ આ ઉત્સવને વધાવી લીધો હતો.

"SANSKARDIP"
R.N.I. 15104/68 Permitted to post at Ahd. PSO on 9th of every month.
Registered under Postal Reg. No. GAMC-1729/2010-2012 valid up to 31-12-2012 issued by SSP
Ahmedabad-9, Licenced to post without Prepayments No. CPMG/GJ/85/10-12/valid upto 31-12-2012

પ. પૂ. જોગીસ્વામીના સાન્નિધ્યમાં પુષ્પદોલોત્સવ પ્રસંગે સદ્ગુરુ વંદના મહોત્સવની જાહેરાત કરતા સદ્ગુરુ સંતો

અખંડ ભગવદ્ પરાયણ પ. પૂ. શ્રી જોગીસ્વામીના ૧૦૮ વર્ષ પૂર્ણ થતાં તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૨ દરમિયાન **'સદ્ગુરુ વંદના મહોત્સવ'** ખૂબજ વિશાળ પાયે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. **'સદ્ગુરુ વંદના મહોત્સવ'** ઉપક્રમે પ. પૂ. શ્રી જોગીસ્વામીના દીર્ઘાયુષ્ય તેમજ સુસ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે ઘેર ઘેર મંત્રલેખન થાય તેવું સંતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં જોડાઇ ભગવાન શ્રીહરિ તેમજ પ. પૂ. જોગીસ્વામીના રાજીપાના પાત્ર બનીએ. **મંત્રલેખન માટેની માહિતી :-** આપના ઘરે ભગવાનની આગળ દીવો પ્રગટાવી આખો પરિવાર, સોસાયટીમાં વસતા પાડોશીઓ તથા સગાં-સંબંધીઓને બોલાવી મહિનામાં એક દિવસ બે કલાક મંત્રલેખન કરવું. આ મંત્રલેખન પૂર્ણ થયા બાદ પ. પૂ. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના મુખે ભગવાન શ્રી સ્વામિનારાયણના મહિમાસભર પ્રવચનોની ડીવીડી સાંભળવી. આપને દર મહિને પ્રવચનોની નવી ડીવીડી પ્રાપ્ત થશે. મંત્રલેખન પૂર્ણ થાય ત્યારે ભગવાનની આરતી કરી શ્રદ્ધા પ્રમાણે મંત્રલેખન કરવા પધારેલા ભક્તજનોને પ્રસાદ વહેંચવો. **નોંધ-** મંત્રલેખનની નોટબુક તેમજ દર મહિને નવી ડીવીડી પ્રાપ્ત કરવા માટે સંપર્ક- પ. પૂ. શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી, **મો.-૯૮૨૫૩૧૫૦૩૦**

If undelivered Please Return to:
Shree Swaminarayan Gurukul
Gurukul Road, Memnagar,
Ahmedabad - 380052

To.